



ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ,

(A Government of Gujarat Undertaking)

"જલસેવા ભવન" છ- રોડ, એરફોર્સ સ્ટેશન સામે, સેક્ટર- ૧૦- એ, ગાંધીનગર

ડી.જી.રામચંદાણી

મુખ્ય ઇજનેર

વેબસાઇટ:- www.gwssb.gujarat.gov.in,

ઇ-મેઇલ:- gwssb.techcell@gmail.com.



જા.નં./ટેકસેલ/જીએસટી/પરિપત્ર /૩૫૧

તા.૧૮/૦૪/૨૦૨૨

પરિપત્ર

- વિષય:-** ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં યોજનાના અમલીકરણની ટેન્ડર પ્રક્રિયામાં જી.એસ.ટી. અંગે સ્પષ્ટીકરણ બાબત.
- સંદર્ભ:-**
- (૧) નાણાં નિયંત્રકશ્રીના પત્ર ક્રમાંક જીડબલ્યુએસએસબી/ એમ.એન્ડ પી./ ૨૦૨૧૧૨૭૨૭/ ૧૧૮૭, તા.૧૭/૧૨/૨૦૨૧.
 - (૨) બોર્ડ કચેરીના પત્ર ક્રમાંક ટેકસેલ/ એસ.ઓ.આર./ ૨૨-૨૩/ ૩૦૯, તા.૧૭/૦૩/૨૦૨૨.
 - (૩) માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: ટીએનસી/૧૦૨૦૨૨/૪૫૭/સી, તા.૦૫/૦૪/૨૦૨૨.
 - (૪) માન. અધ્યક્ષશ્રીની સરખા ક્રમાંકની ફાઇલ પરની તા.૧૬/૦૪/૨૦૨૨ની મંજૂરી.

પરિપત્ર:-

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં હાથ ધરવામાં આવતાં યોજનાકીય કામોની ટેન્ડર પ્રક્રિયામાં કેન્દ્ર સરકારના તા.૧૮/૧૧/૨૦૨૧ના નોટીફિકેશન નં- ૧૫/ ૨૦૨૧ અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૨થી વર્કસ કોન્ટ્રાક્ટ પર જી.એસ.ટી. નો દર ૧૮ ટકા થયેલ છે. જેને અનુલક્ષિને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ની ભાવસૂચિ જી.એસ.ટી. ના દર મુજબ અમલીકૃત કરવામાં આવેલ છે.

યોજનાકીય કામોના અંદાજોની તાંત્રિક ચકાસણી સમિતિ અને બોર્ડ બેઠકમાં મંજૂરી જી.એસ.ટી. સાથેના ભાવપત્રક માટે લેવાની રહેશે. જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને નાણાકીય સરળતા માટે ટેન્ડર પ્રક્રિયામાં તાંત્રિક મંજૂરી, સમગ્ર તાંત્રિક મંજૂરી અને ફાઇટ ટેન્ડર પેપરની મંજૂરી જી.એસ.ટી. વગરના ભાવો મુજબ આપી ટેન્ડર પ્રસિધ્ધ કરવાના રહેશે.

ટેન્ડર ડોક્યુમેન્ટમાં ભાવો જી.એસ.ટી. વગરના છે. તે બાબતે સંબંધિત તમામ ટેન્ડરની કલમોમાં ઉલ્લેખ કરી એજન્ટીએ ભાવો જી.એસ.ટી. વગરના ભરવાના રહેશે અને ટેન્ડરની સરખામણી અને મંજૂરી તે મુજબ થશે તથા થયેલ યોજનાકીય કામોનું વાસ્તવિક કરવાપાત્ર ચુકવણું જી.એસ.ટી. સાથે કરવામાં આવશે. તે બાબતે સ્પષ્ટીકરણ કરવાનું રહેશે. યોજનાકીય કામોમાં સુચિત સ્ટાર રેટના આધારે પ્રવર્તમાન જોગવાઈ/ધારાધોરણ મુજબ ભાવ વધારાનું ચુકવણું પણ નિયત ગણતરી મુજબ જી.એસ.ટી. સાથે કરવાપાત્ર રહેશે. જે અંગે માર્ગદર્શન માટે સરખામણી પત્રક સામેલ છે.

આ બાબતનું અમલીકરણ તાત્કાલિક અસરથી કરવાનું રહેશે.

(ડી.જી.રામચંદાણી)

મુખ્ય ઇજનેર

બિડણ:- સરખામણી પત્રક, વોલ્યુમ-૧ બી ક્લોઝ-૫૯

નકલ સાદર રવાના પ્રતિ,

- માન. અધ્યક્ષશ્રીના કાર્યકારી સચિવશ્રી. ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- સભ્ય સચિવશ્રી, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- મુખ્ય કારોબારી અધિકારીશ્રી, વાસ્મો, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- મુખ્ય ઇજનેરશ્રી, મટીરીયલ/ યાંત્રિક, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- મુખ્ય ઇજનેરશ્રી, ઓન-૧, વડોદરા, ઓન-૨, અમદાવાદ, ઓન-૩, રાજકોટ, ઓન-૪, કચ્છ-ભૂજ, ઓન- ૫, જુનાગઢ, ઓન-૬, સુરત
- પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, અર્બન સેલ, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- ચીફ જનરલ મેનેજરશ્રી (પ્રોજેક્ટ), જી.ડબલ્યુ.આઈ.એલ., ગાંધીનગર
- નાણા નિયંત્રકશ્રી, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- માસ્ટર ફાઇલ.

VOLUME - IB

General Conditions of Contract

Prevailing Condition	Revised condition
<p>(CLAUSE -47) Rates inclusive of Sale Tax/ VAT and all other taxes except service tax.</p> <p>The rates to be quoted by the contractor must be inclusive of sales tax/ VAT & all other taxes. No extra payment on this account will be made to the contractor.</p> <p>NOTE:</p> <p>a) Service tax shall be payable extra subject to applicability of Service Tax, against documentary evidence/ invoice. Statutory variation and any additional taxes levied during contract period shall not be payable.</p> <p>b) In case of implementation of Goods and Service Tax Act (GST) in Gujarat, the variation in tax liability on account of GST on that part of value of contract, for which goods and services are procured after the implementation of GST in Gujarat, shall be reimbursed/ recovered.</p>	<p>(CLAUSE -47) Rates are exclusive of GST but inclusive of all other taxes</p> <p>The rates to be quoted by the contractor must be exclusive of GST but inclusive of all other taxes. GST should be paid extra on the admissible payment as per the approved tender rates and condition of price variation; GST should be paid as per prevailing rates at the time of payment.</p>



VOLUME - III

PRICE BID

PREAMBLE TO PRICE SCHEDULE

Prevailing Condition	Revised condition
(26) The prices shall be quoted inclusive of all taxes, royalties and duties prevailing at the time of submission of the bids. Statutory variation if any during the currency of contract shall have to borne by the agency which shall be not reimbursed by the GWSSB.	(26)The rates quoted shall be exclusive of GST, but inclusive of all other taxes, duties which shall not be paid extra. While GST will be paid for admissible part of actual work done at the approved tender rates and tender conditions of price variations. GST shall be paid as per prevailing rates at the time of payment. The TDS shall be deducted at source as per provision of IT rules and GWSSB policy.
(27) The rates should be quoted inclusive of Sale Tax/ VAT and all other taxes except service tax as per Volume-I(B), General Conditions of Contract, Clause No. 47.	(27)The rates should be quoted exclusive of GST but inclusive of all other taxes as per Volume-I (B), General Conditions of Contract, Clause No. 47.



VOLUME - IB

General Conditions of Contract

(CLAUSE-59) Price Variation Clause:

a) PRICE VARIATION FOR H.R. COIL (M.S. PIPES) BROUGHT BY CONTRACTOR:

The price variation shall be based on the latest Monthly wholesale price index declared by office of Economic Advisor to GOI, Ministry of Commerce & Industries. Price Index is available on web site: <http://eaindustry.nic.in>

The amounts payable to the contractors for the work done involving use of HR Coil when these materials are not supplied by the Government as for Schedule-A price shall be adjusted for increase or decrease in the rates of these materials as under:

The star rates for H.R. Coil as per SOR to be brought by the Contractor shall be considered Ex-supply Depot/ Godown as under:

SL. NO.	ITEM	STAR RATE (excluding GST as per SOR)
1	HR Coil (HRC) Above 3.15 to 10 mm thick	Rs. per MT

The above star rates are linked with Wholesale Price Index (WPI) as issued by Economic Advisor, Ministry of Commerce and Industries for the month in which the last date of submission of bid.

The fluctuations in rates of HR Coil shall be adjusted in the bills payable to the contractor as under:



$$A = \{ B * \{(C1/C0) - 1\} * D \}$$

Where:

- A = Difference of Amount payable or recoverable
- B = Star rate of HR Coil (HRC)- Excluding GST.
- C1 = The (quarterly) average corresponding index for HR Coil (HRC) for the quarter under consideration i.e. on the date of Inspection of pipe Offered.
- (Wholesale Price Index (WPI) as issued by Economic Advisor, Ministry of Commerce and Industries)
- Co = Price index of HR Coil (HRC) for the month in which DTP are approved (Wholesale Price Index (WPI) as issued by Economic Advisor, Ministry of Commerce and Industries)
- D = Qty. of HR Coil actually brought by the contractor on site of work and consumed in the work during the quarter duly supported with bill as recorded in consumption register and MB (MB for HR Coil (HRC)).

The following wholesale price index shall be referred for value of C1 & C0 in the above referred formula:

The quarter referred to in all the above formula shall mean the quarter of the calendar year January to March, April to June, July to September and October to December. Even if the tenders are opened in the middle of a quarter, the average index for the calendar quarter will be considered. The same principle would apply for identifying the quarter when the work is completed in the middle of calendar quarter.



NO.	ITEM	REFERENCE -Wholesale Price Index (WPI) as issued by Economic Advisor, Ministry of Commerce and Industries
1	HR Coil	HRC

PRICE VARIATION EFFECTS

Condition for variation in prices of HR Coil (HRC) only:

1. No Ceiling for escalation for difference in the cost of HR Coil (HRC) will be applicable.
2. This clause shall be operative from the date of issue of work order and up to the expiry of original time limit and extended time limit if Liquidated Damage is not imposed.
3. This formula shall be used individually for HR Coil (HRC) for calculating adjustment.
4. The HR Coil (HRC) brought by the contractor on site of work shall be used only after the same is tested by the Department.
5. If such materials are not found as per the requirement of I.S. specification/ Tender specification, the same shall be removed by the contractor for which no claim shall be entertained.
6. This clause will be applied to the work irrespective of the cost of the work.

If the time limit is extended without penalty and the delay does not pertain to the contractor, then in such case Price Variation on the pipes shall be applicable restricted to the Bill of Quantities mentioned in tenders.

If the time limit is extended with the penalty, then days on which penalty is arrived shall be counted from the actual date of completion. For pipes



purchased during the penalty days, positive price variation shall not be applicable, where as negative variation is applicable.

Price variation on all type of pipes in case of Excess and Extra Item shall be payable/ recoverable subject to below mentioned conditions.

1. Excess due to shifting of location of the Head works as per availability of land and technical reasons.
2. Due to increase in number of villages
3. Due to change in alignment of the pipeline
4. Excess/ Extra item due to change in type of pipes.
5. Price variation shall be allowed up to increase of 10% of overall length of all types of pipelines mentioned in BOQ of the tender and subject to conditions mentioned above.

Price variation effect shall be calculated by concerned Division & shall be verified by paying authority prior to making payment.

Condition for variation:

1. This clause shall be operative from the date of issue of LOI and up to the expiry of original time limit.
2. Price escalation shall be granted for the diameter of pipes and length mentioned in the price bid.
3. In case of any discrepancy/dispute regarding application of price variation clause, decision of concerned Chief Engineer shall be final and binding to the contractor.

b) PRICE VARIATION FOR uPVC PIPES:

- i. The price variation will be based on Prime Grade 67 GER 01 (Formerly known as A Grade 67 GER 092) announced by IPCL from time to time.
- ii. The rate of PVC resin as per SOR on which tenders are invited
(Excluding Freight), Rs.per MT (Excluding GST)



For purpose of variation, 900Kgs of PVC resin will be considered for one tonne of PVC pipes. In the event of any variation, prices will be calculated as:

$$P = \{ 0.90 (A-B) * C \}$$

Where:

- P : Price Variation per tonne
- A : Current Price of PVC resin per tonne fixed by IPCL on the date of inspection of pipe offered. (excluding GST)
- B : Price of PVC resin per tonne i.e. **Rs.per MT (excluding GST as per SOR on which tenders are invited)**
- C : Weight of pipe (In this case value of C= 1 Tonne)
- * = Means multiplication

Note: Price of PVC resin per tonne shall be considered after deducting regional subsidy if any declared by the IPCL.

PRICE VARIATION EFFECTS

If the time limit is extended without penalty and the delay does not pertain to the contractor, then in such case Price Variation on the pipes shall be applicable restricted to the Bill of Quantities mentioned in tenders.

If the time limit is extended with the penalty, than days on which penalty is arrived shall be counted from the actual date of completion. For pipes purchased during the penalty days, positive price variation shall not be applicable, where as negative variation is applicable.

Price variation on all type of pipes in case of Excess and Extra Item shall be payable/ recoverable subject to below mentioned conditions.



1. Excess due to shifting of location of the Head works as per availability of land and technical reasons.
2. Due to increase in number of villages
3. Due to change in alignment of the pipeline
4. Excess/ Extra item due to change in type of pipes.
5. Price variation shall be allowed up to increase of 10% of overall length of all types of pipelines mentioned in BOQ of the tender and subject to conditions mentioned above.

Price variation effect shall be calculated by concerned Division & shall be verified by paying authority prior to making payment.

The contractor shall have to give undertaking at the time of claiming their bills for price variation as under:

"We hereby certify that the uPVC resin of the uPVC Pipes for which the bill preferred is not purchased through any Government or Semi Government undertaking at the concession rate".

Condition for variation:

1. This clause shall be operative from the date of issue of LOI and up to the expiry of original time limit.
2. Price escalation shall be granted for the diameter of pipes and length mentioned in the price bid.
3. In case of any discrepancy/dispute regarding application of price variation clause, decision of concerned Chief Engineer shall be final and binding to the contractor.

c) PRICE VARIATION FOR HDPE PIPES:

- i. The price variation will be based on **A Grade 46 GP 003 (i.e. PE-100)** announced by IPCL from time to time.
- ii. The rate of HDPE resin as per SOR is as under (exclusive freight).



For PE-100: Rs. per MT (46 GP 003) (excluding GST)

For purpose of variation, 1000 Kgs of HDPE resin will be considered for one tonne of HDPE pipes. In event of any variation, prices will be calculated as following:

$$P = \{(A-B) * C\}$$

where:

- P : Price Variation per tonne
- A : Current Price of HDPE resin per tonne fixed by IPCL on the date of inspection of pipe offered. (excluding GST)
- B : Price of HDPE resin per tonne i.e. Rs.per MT (excluding GST as per SOR on which tenders are invited)
- C : Weight of pipe (In this case value of C= 1 Tonne)
- * = Means multiplication
- Note** : Price of HDPE resin per tonne shall be considered after deducting regional subsidy if any declared by the IPCL.

PRICE VARIATION EFFECTS

If the time limit is extended without penalty and the delay does not pertain to the contractor, then in such case Price Variation on the pipes shall be applicable restricted to the Bill of Quantities mentioned in tenders.

If the time limit is extended with the penalty, than days on which penalty is arrived shall be counted from the actual date of completion. For pipes purchased during the penalty days, positive price variation shall not be applicable, where as negative variation is applicable.



Price variation on all type of pipes in case of Excess and Extra Item shall be payable/ recoverable subject to below mentioned conditions.

1. Excess due to shifting of location of the Head works as per availability of land and technical reasons.
2. Due to increase in number of villages
3. Due to change in alignment of the pipeline
4. Excess/ Extra item due to change in type of pipes.
5. Price variation shall be allowed up to increase of 10% of overall length of all types of pipelines mentioned in BOQ of the tender and subject to conditions mentioned above.

Price variation effect shall be calculated by concerned Division & shall be verified by paying authority prior to making payment.

The contractor shall have to give undertaking at the time of claiming their bills for price variation as under:

"We here by certify that the HDPE resin of the HDPE Pipes for which the bill preferred is not purchased through any Government or Semi Government undertaking at the concession rate".

Condition for variation:

1. This clause shall be operative from the date of issue of LOI and up to the expiry of original time limit.
2. Price escalation shall be granted for the diameter of pipes and length mentioned in the price bid.
3. In case of any discrepancy/dispute regarding application of price variation clause, decision of concerned Chief Engineer shall be final and binding to the contractor.



d) PRICE VARIATION FOR DUCTILE IRON PIPES:

The price variation shall be based on the latest Monthly wholesale price index declared by office of Economic Advisor to GOI, Ministry of Commerce & Industries. Price Index is available on website: <http://eaindustry.nic.in>

wholesale price index of Pig Iron shall be considered as **"Base Index" (Rate as per SOR on basis of which tender are invited)** for this tender.

Price variation in the rates of DI pipe shall be calculated on account of variation in monthly wholesale price index (**WPI**) of Pig Iron with base index. In event of any variation, prices will be calculated as per formula given below:

$$P = \{R_1 + 0.65 [\{ (I_1 - I_0) / I_0 \} \times R_0] \}$$

Where:

- P** = Effective New Price Considering Variation in Rs. / Mtr.
- R₀** = Value of R₀ for DI pipe based on Wholesale Price Index of Pig Iron as mentioned in GWSSB Schedule of Rates are as below:

Sl. No.	Size as per SOR (In mm)	Rupees/ Mtr. Rate as per SOR on basis of which tender are invited.
1.		
2.		

- I₁** = Current Monthly Wholesale Price Index of Pig Iron as per price variation effect on the date of Inspection of pipe Offered
- I₀** = Monthly Wholesale Price Index of PIG Iron given as Base Index as per SOR on which tenders are invited



R₁ = Approved rate of Consolidated Item of Contractor

***** = Means multiplication

PRICE VARIATION EFFECTS

If the time limit is extended without penalty and the delay does not pertain to the contractor, then in such case Price Variation on the pipes shall be applicable restricted to the Bill of Quantities mentioned in tenders.

If the time limit is extended with the penalty, then days on which penalty is arrived shall be counted from the actual date of completion. For pipes purchased during the penalty days, positive price variation shall not be applicable, where as negative variation is applicable.

Price variation on all type of pipes in case of Excess and Extra Item shall be payable/ recoverable subject to below mentioned conditions.

1. Excess due to shifting of location of the Head works as per availability of land and technical reasons.
2. Due to increase in number of villages
3. Due to change in alignment of the pipeline
4. Excess/ Extra item due to change in type of pipes.
5. Price variation shall be allowed up to increase of 10% of overall length of all types of pipelines mentioned in BOQ of the tender and subject to conditions mentioned above.

Price variation effect shall be calculated by concerned Division & shall be verified by paying authority prior to making payment.

The contractor shall have to give undertaking at the time of claiming their bills for price variation as under:

"We hereby certify that the Pig Iron of the DI Pipes for which the bill preferred is not purchased through any Government or Semi Government undertaking at the concession rate".



Condition for variation:

1. This clause shall be operative from the date of issue of LOI and up to the expiry of original time limit.
2. Price escalation shall be granted for the diameter of pipes and length mentioned in the price bid.
3. In case of any discrepancy/dispute regarding application of price variation clause, decision of concerned Chief Engineer shall be final and binding to the contractor.

Guidelines:

- a. *The value of R_0 shall be taken as per GWSSB SOR which has been referred for preparing the estimated cost.*
- b. *The various sizes of DI pipe which has been referred for preparing the estimated cost (as per their grade) shall be mentioned in the table of R_0 .*





ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

જલસેવા ભવન, સે.૧૦-એ ગાંધીનગર.

ફોન નં. (૦૭૯) ૨૩૨૫૧૦૪૮, ૯૯૭૮૪૪૧૦૨

ફેક્સ: (૦૭૯) ૨૩૨૨૫૯૭૯

Website: www.gwssb.gujarat.gov.in

E-mail: fcgwssb@gmail.com

નં. GWSSB/AB/M-1-2/GST/2020-21/ 36

તા. ૦૨/૦૧/૨૦૨૧

પ્રતિ,

(૧) મુખ્ય ઈજનેરશ્રી,

ઝોન-૧/૨/૩/૪/૫/સુરત

વડોદરા/અમદાવાદ/રાજકોટ/ભુજ-કચ્છ/જુનાગઢ/સુરત

ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ

(૨) નિયામકશ્રી, ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ, સુરત.
આવક નં. 161
તારીખ 31/1/22
કોને સંબંધિત A347/PB
કચેરી અધિકારી
અંગત મદદનીશ
ચ. વિશ્વકર્મા

વિષય: ઓનલાઈન ટેન્ડરોમાં સુધારો (Corrigendum) બહાર પાડવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઓનલાઈન ટેન્ડરોમાં ઇજારદારો દ્વારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવતા વર્કસ કોન્ટ્રાક્ટ/મરામત અને નિભાવણી/ Services with material/Pure Serviceની કોન્ટ્રાક્ટ માટે પ્રવર્તમાન જીએસટી રેઈટ ધ્યાને ઇજારદારો દ્વારા ભાવ ભરવામાં આવે છે. કમ સરકારના તા.૧૮/૧૧/૨૦૨૧ના નોટિફિકેશન નં.૧૫/૨૦૨૧ અને ૧૬/૨૦૨૧ અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૨થી કોન્ટ્રાક્ટ/મરામત અને નિભાવણી/ Services with material/Pure Serviceની કોન્ટ્રાક્ટ માટે જીએસટી રેઈટ ૧૮% કરવામાં આવેલ છે.

ઉક્ત બાબત ધ્યાને લઈ તમામ ઇજારદારોને ઓનલાઈન ટેન્ડરોમાં ૧૮% જીએસટી રેઈટ પ્રમાણે ભાવો ભરવા તથા ભવિષ્યમાં જીએસટી રેઈટમાં ૧૮%થી કોઈ વધઘટ થાય તો તેનો તજવત સરભર કરવામાં આવશે તે બાબત સૂચિત કરવા ઓનલાઈન ટેન્ડરોમાં આ સાથે સામેલ સુધારો (Corrigendum) બહાર પાડવા જણાવવામાં આવે છે.

(ક્ષર્ણ પર માન. અધ્યક્ષશ્રીની મંજૂરીથી)

બિડાણ: Corrigendum

નકલ સવિનય રવાના પ્રતિ

૧. માન. સભ્ય સચિવશ્રીના અંગત સચિવશ્રી

૨. મુખ્ય ઈજનેરશ્રી (સર્વે), વડી કચેરી, ગાંધીનગર

(એમ. પી. પુજારા)

ધેરા ક્રમાંક. ૬૪ નાણાં નિયંત્રક તારીખ. ૦૨/૦૧/૨૦૨૧
અધિક્ષક ઈજનેરશ્રી

જ.આ. વર્ણન

જીએસટી રેઈટમાં ૧૮% થી વધારાના ભાગે સરકાર તેમજ

આજના જોગ્ય કાર્યવાહી કરવાની વિનંતિ સહ

કાર્યવાહી ઇજનેર

ઝોન-૬, સુરત.

નકલ રવાના:-

પ્રતિ,

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ, ગાંધીનગર

Amendment-I

Amendments made to Tender Condition

Name of work:- _____

Tender Id : _____

-: Instructions to the bidders :-

These instructions are in relation to applicable GST Rate in relation to procurement of services or in works contract where material component is less than 25% in value or Pure Services contract or Partial Material & Partial Services Contract. The rates to be quoted by the Contractor must be inclusive of all taxes including GST. Bidder must take note that till December 31st, 2021, the applicable GST rate on Composite supply of goods and services (Works Contract) has been 12% and services in which the value of supply of goods constitutes not more than 25 percent which has been considered as Pure services Procurement and GST rate on the same has been "nil".

However, now as per the Central Government Notifications no. 15/2021 & 16/2021 – Central Tax (Rate) dated 18.11.2021 issued by Ministry of finance (Department of Revenue) applicable GST rates for the works having Composite supply of goods and services or Pure Services or services in which the value of supply of goods constitutes not more than 25 percent on pure service contracts to be executed by GWIL/GWSSB will become 18 % operative on January 1st, 2022.

Therefore, contractor shall, while quoting his rates in response to all tenders by GWIL/GWSSB must consider applicable GST rate as 18 %, and incorporating that as part of Prices to be quoted by him.

Contractor shall also note that any subsequent change in the applicable GST on works/services contract by GWIL/GWSSB (from 18%) after due date of bid submission will be recovered /reimbursed (+/-) on availability of submission of actual documentation. Contractor has to intimate Engineer in charge regarding changes occurred in the GST on works/services contract after bid submission. If contractor fails to provide such information and if any financial obligation arises due to change in GST related tax structure, same will be recovered from the contractor.

The contractor shall apply fair means of stock maintenance and shall adopt accounting standards as are and may be prescribed under GST. For arriving at implication due to change in GST rate on Works/Services Contract from 18%, it will be open for GWIL/GWSSB to ask for original invoices, LR, weigh bridge slips, payment details and such other documents as may be required for the purpose.

This corrigendum will be considered as a part of the tender and shall have over-riding effect on any other clause in any part of the tender document, in so far as such clause deals with applicable GST rates on works or services or O & M related tenders.

Executive Engineer/ Superintendent Engineer
(Concern)

598

21/2/22

(P) B A B T C

જા.નં.પીબી/ટેન્કર સુધારો 1929

તા. 08/02/2022

નકલ સાદર રવાના પ્રતિ, કાર્યપાલક ઇજનેરશ્રી, જા.આ.બાંધકામ/યાંત્રિક વિભાગ, વડોદરા/છોટાઉદેપુર તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી સારું.

- નકલ રવાના પ્રતિ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જા.આ.સુખાકારી/યાંત્રિક પેટા વિભાગ, સર્વે તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી કરવા સારું.
- માસ્ટર ફાઇલ.

(18/5)

નાયબ કાર્યપાલક ઇજનેર
જા.આ.બાંધકામ/યાંત્રિક વિભાગ
વડોદરા/છોટાઉદેપુર



ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

જલસેવા ભવન, સે.૧૦-એ ગાંધીનગર.



એમ. પી. પુજારા

ફોન નં. (૦૭૯) ૨૩૨૫૧૦૪૮, ૯૯૭૮૪૪૧૧૦૨

ફેક્સ: (૦૭૯) ૨૩૨૨૫૯૭૯

નાણાં નિયંત્રક

Website: www.gwssb.gujarat.gov.in

E-mail: fcgwssb@gmail.com

નં. GWSB/MFP/2021/2727 / 1187

તા. ૧૭/૧૨/૨૦૨૧

પ્રતિ,

(૧) મુખ્ય ઇજનેરશ્રી,

ઝોન-૧/૨/૩/૪/૫/સુરત

વડોદરા/અમદાવાદ/રાજકોટ/ભુજ-કચ્છ/જુનાગઢ/સુરત

ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ

(૨) નિયામકશ્રી, ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર

વિષય: હાલ ઓનલાઈન ટેન્ડરોમાં સુધારો (Corrigendum) બહાર પાડવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઓનલાઈન ટેન્ડરોમાં ઇજારદારો દ્વારા પાણી પુરવઠા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવતા વર્કસ કોન્ટ્રાક્ટ માટે પ્રવર્તમાન જીએસટી રેઈટ ૧૨% ધ્યાને ઇજારદારો દ્વારા ભાવ ભરવામાં આવે છે. કેન્દ્ર સરકારના તા.૧૮/૧૧/૨૦૨૧ના નોટિફિકેશન નં.૧૫/૨૦૨૧ અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૨થી વર્કસ કોન્ટ્રાક્ટ માટે જીએસટી રેઈટ ૧૮% કરવામાં આવેલ છે.

ઉક્ત બાબત ધ્યાને લઈ તમામ ઇજારદારોને ઓનલાઈન ટેન્ડરોમાં ૧૮% જીએસટી રેઈટ પ્રમાણે ભાવો ભરવા તથા ભવિષ્યમાં જીએસટી રેઈટમાં ૧૮%થી કોઈ વધઘટ થાય તો તેનો તફાવત સરભર કરવામાં આવશે તે બાબત સૂચિત કરવા હાલ ઓનલાઈન ટેન્ડરોમાં આ સાથે સામેલ સુધારો (Corrigendum) બહાર પાડવા તથા ટેન્ડરની બીડ સબમીશનની તારીખ ૩ (ત્રણ) દિવસ લંબાવવા જણાવવામાં આવે છે.

(ફાઈલ પર માન. અધ્યક્ષશ્રીની મંજૂરીથી)

બિડાર: Corrigendum

A. WORKS DN.	
YADODARA.	
Work No.	4392
Date	28/12/22
Branch	AB+C
Regd./Bkptd.	
Br. Engr.	ansh

(એમ. પી. પુજારા)

નાણાં નિયંત્રક

(PTO)

(Concern)
જાન એપ્રિલ/૨૦૨૧ | ૦૮ | ૨૦૨૨
dt. ૧/૧/૨૦૨૨
ગરબ રવાના પ્રતિ ગામનું કાર્યાલય ઉજવેશી
ગરબ રવાના કરી પેરા (વિભાગ) વડાદરો, સગાઈ કુટુંબ સંબંધી તરફ
જાણ સારીતથા પત્રને વેચાણે લઈ તબક્કાલિફ એસર બી એસર કુટુંબ સંબંધી.
X *Handwritten Signature*
કાર્યાલયક ઉજવેશી
તરફ આરોગ્ય બાંધકામ વિભાગ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

જલસેવા ભવન સે.૧૦-એ ગાંધીનગર

ફોન નં. (૦૭૯) ૨૩૨૫૧૦૪૮ ૯૯૭૮૪૪૧૧૦૨ ફેક્સ: (૦૭૯) ૨૩૨૨૫૯૭૯

એસ.જી.પટેલ

Website: www.gwssb.gujarat.gov.in E-mail: fcgwssb@gmail.com

નાણાં નિયંત્રક

પરિપત્ર ક્રમાંક: એબી/સી.મે.૧-૨/ GST-TDS/ફા.નં.-૫૦/૩૭૮

તા.૨૧/૦૮/૨૦૧૮

પ્રતિ,

(૧) મુખ્ય ઇજનેરશ્રી ઝોન - ૧-૨-૩-૪-પ / વડોદરા,અમદાવાદ,રાજકોટ, ભુજ,જુનાગઢ

(૨) નિયામકશ્રી જલ સેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર.

(૩) કાર્યપાલક ઇજનેરશ્રી (યાંત્રિક), જા.આ.યાં સ્ટોર વિભાગ, ગાંધીનગર.

વિષય:- સરકારશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૧૮ થી અમલી બનાવવામાં આવેલ GST-TDS અન્વયે જરૂરી કાર્યવાહિ કરવા બાબત.

સંદર્ભ:- (૧) ભારત સરકારના મહેસૂલ વિભાગના અંગ્રેજી પરિપત્ર ક્રમાંક 65/39/2018 - DDR તા.૧૪/૦૯/૨૦૧૮

(૨) રાજ્ય સરકારના નાણાં વિભાગના અંગ્રેજી જાહેરનામા ક્રમાંક ૫૦/૨૦૧૮ - State Tax તા.૧૫/૦૯/૨૦૧૮

(૩) રાજ્ય સરકારના નાણાં વિભાગના પરિપત્ર ક્રમાંક જીએસટી/૧૦૧૭/૧૦૯૭/જીએસટી સેલ તા.૧૫/૦૯/૨૦૧૮

(૪) અત્રેના પત્ર ક્રમાંક AB/SM 1-2/File No.71/126/2017, તા. 03/05/20૧૭

પ્રસ્તાવના

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અનુક્રમે સંદર્ભ (૧) અને (૨) પ્રમાણેના પરિપત્ર અને જાહેરનામાથી તા.૦૧/૧૦/૨૦૧૮ થી GST અન્વયે TDS (Tax Deduction at Source) ની જોગવાઈઓ અમલી બનાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના સંદર્ભ (૩) પ્રમાણેના પરિપત્રથી GST-TDS કરનાર દ્વારા નોંધણી નં.(Registration No.) મેળવવા બાબતે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરેલ છે. આ અનુસંધાને અત્રેથી નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.

(૧) ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ ૨૦૧૭ તથા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ ૨૦૧૭ની કલમ ૫૧ અનુસાર રૂ.૨,૫૦,૦૦૦/- (રૂપિયા બે લાખ પચાસ હજાર) થી વધુની કરાર કિંમતના માલ કે સેવાના સપ્લાય અંગે નાણાંની ચૂકવણી કરતી વખતે, ચૂકવણી કરનાર દ્વારા ૨% GST-TDS કપાત કરવાનો રહેશે. આ પૈકિ ૧% સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) હેઠળ અને ૧% સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) હેઠળ કપાત કરવાની રહેશે. આ સિવાય અમુક સંજોગોમાં સીધી જ ૨% રકમની IGST તરીકે કપાત કરવાની રહેશે. CGST Act ની કલમ ૫૧ આ સાથે પરિશિષ્ટ-અ મુજબ સામેલ છે.

આ ચૂકવણી કરવી કપાત કરવી તેની વિગત નીચે ફકરા નં(૨) માં આપેલ છે.

P. M. WORKS DN. VADODARA.	
In. Word No.	૪૩૨૫
Date	૨૧/૮/૧૮
Branch	ABTC
Asst. Supdt.	Oy.
Engr.	

(૨) GST-TDS ની કપાત સંદર્ભે નીચેની વિગતો ધ્યાને લેવા જણાવવામાં આવે છે:

(અ) જો સપ્લાયર માલ અને સેવા પૂરી પાડવાનું સ્થળ અને તે માલ/સેવા મેળવનાર એક જ રાજ્યમાં હોય તો આવો સપ્લાય intra-State supply ગણાશે અને તે સંજોગોમાં ઉપર જણાવ્યા મુજબ ૧% સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) હેઠળ અને ૧% સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) હેઠળ કપાત કરવાની રહેશે (Supplier, place of supply and recipient are in the same state. It would be intra-State supply and TDS (Central plus State tax) shall be deducted. It would be possible for the supplier (i.e. the deductee) to take credit of TDS in his electronic cash ledger)

(બ) જો સપ્લાયર તથા માલ અને સેવા પૂરી પાડવાનું સ્થળ બંને અલગ રાજ્યમાં હોય તો તેવા કિસ્સામાં IGST તરીકે ૨% રકમની તરીકે કપાત કરવાની રહેશે. (Supplier as well as the place of supply are in different states. In such cases, Integrated tax would be levied. TDS to be deducted would be TDS (Integrated tax) and it would be possible for the supplier (i.e. the deductee) to take credit of TDS in his electronic cash ledger)

(ક) જો સપ્લાયર તથા માલ અને સેવા પૂરી પાડવાનું સ્થળ બંને એક રાજ્યમાં હોય અને તે મેળવનાર અન્ય રાજ્યમાં સ્થિત હોય તેવા સંજોગોમાં તે intra-State supply તરીકે ગણાશે અને તે પર GST પેટે કોઈ TDS કપાત કરવાપાત્ર નહીં થાય. (Supplier as well as the place of supply are in State A and the recipient is located in State B. The supply would be intra-State supply and Central tax and State tax would be levied. In such case, transfer of TDS (Central tax + State tax of State B) to the cash ledger of the supplier (Central tax + State tax of State A) would be difficult. So in such cases, TDS would not be deducted)

ઉપરોક્ત ત્રણે પરિસ્થિતિ આ સાથે સામેલ પરિશિષ્ટ-૬ મુજબના ચાર્ટમાં સ્પષ્ટ કરેલ છે.

(૩) આ કપાત કરેલ રકમ જે મહિનામાં કપાત થયેલ હોય તે માસના પૂર્ણ થયેથી દસ દિવસની અંદર નીચે જણાવેલ સદરે સરકારી તિજોરીમાં જમા કરાવવાના રહેશે.

SGST	00060010101
CGST	00050010101

(૩.૧) આ TDS ની રકમ અંગે જે તે માસ પૂર્ણ થયેથી દીન-૧૦ માં સરકારમાં ચલણથી જમા કરાવવાની રહેશે. જો નિયત સમય મર્યાદામાં આ રકમ જમા નહીં કરાવવામાં આવે તો તેની પર ૧૮% દરે વ્યાજ ભરવાપાત્ર થશે.

(૩.૨) આ TDS અંગે જે તે માસ પૂર્ણ થયેથી દીન-૧૦ માં GSTR-7 પ્રમાણેના નમૂનામાં રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. જો નિયત સમય મર્યાદામાં આ રિટર્ન ફાઇલિંગ નહિ થાય તો પ્રતિદિન રૂ.૧૦૦/- મુજબ late filing charge (Maximum up to Rs. 5000/-) ભરવાપાત્ર થશે.

ઉપરોક્ત વિગતો નિગાહે લઈ આ બાબતે યોગ્ય તકેદારી લેવા જણાવવામાં આવે છે.

- (૪) આ રીતે GST-TDS, જે એજન્સીના બીલમાંથી કપાત કરેલ હોય તે એજન્સીને કપાત કરનારે નમૂના GSTR-7-A માં પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- (૫) ગુ.પા.પુ અને ગ.વ્ય બોર્ડના હિસાબોમાં આ ૨% GSTની કપાત નીચેના હિસાબી સદરોએ જમા લેવાની રહેશે.

Account Head	1313(01)	SGST
Account Head	1313(02)	CGST
Account Head	1313(03)	IGST

- (૬) ઉક્ત જોગવાઈઓનો અમલ તા.૦૧.૧૦.૨૦૧૮થી કરવાનો હોય GST નેટવર્ક ઉપર ઓનલાઇન જરૂરી વિગતો ભરી, આવશ્યક દસ્તાવેજો અપલોડ કરીને GST-TDS નો રજીસ્ટ્રેશન નંબર મેળવવો અનિવાર્ય છે. ગુ.પા.પુ અને ગ.વ્ય બોર્ડની ચૂકવણા કચેરીઓના GST-TDS માટેના રજીસ્ટ્રેશન નંબર મેળવી આપવા બાબતની કામગીરી અત્રેના સંદર્ભ (૪) પ્રમાણેના પત્રથી, સુનિલ ઠક્કર એન્ડ કં., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને આપવામાં આવેલ છે. જે ચૂકવણા કચેરીના GST-TDS નંબર (GTN) હજુ મળેલ ન હોય/લીધેલ ન હોય તેઓને સદરહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી સાથે સંપર્કમાં રહી, તાત્કાલિક આ કામગીરી પુર્ણ કરવા જણાવવામાં આવે છે. આ પેઢીના સંપર્કની વિગતો નીચે મુજબ છે.

સુનિલ ઠક્કર એન્ડ કં.,

"ફર્થ એવન્યુ", નવજીવન પ્રેસ રોડ,

ઇન્ડમટેક્સ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નં. ૯૯૨૫૨૪૩૮૩૯

તા.૦૧/૧૦/૨૦૧૮ થી ૩૧/૧૦/૨૦૧૮ સુધીમાં કપાત કરેલ GST-TDS સરકારશ્રીમાં ચલનથી ભરી, તે અંગેનું GSTR-7 (Return Filling) તા. ૧૦/૧૧/૨૦૧૮ સુધીમાં ભરવાપાત્ર થશે. આ બંને હેતુસર GST-TDS કરનાર કચેરી પાસે GST-TDS નંબર (GTN) હોવો અનિવાર્ય છે, તેના વિના આ કામગીરી કરી શકાશે નહીં અને ભવિષ્યમાં પ્રશ્નો ઉપસ્થિત થવા પામશે. આ બાબત ગંભીરતાથી નોંધ લઈ, GST-TDS નંબર (GTN) અવશ્યપણે મેળવી લેવા જણાવવામાં આવે છે.

- (૭) GSTની કપાત કર્યા બાદ આ અંગે પ્રતિમાસ ભરવાપાત્ર થતા GSTR-7 (Return Filling) અન્વયે અન્ય સૂચનાઓ આગામી સમયમાં પરિપત્રિત કરવામાં આવશે. આ સાથે સંદર્ભમાં જણાવેલ તમામ પરિપત્રો / જાહેરનામાની નકલ જાણ સારૂ સામેલ છે.

ઉક્ત વિગતે જરૂરી કાર્યવાહિ કરવા જણાવવામાં આવે છે.

વિડાણ : ઉપર મુજબ

(એસ.જી.પટેલ)

નાણાં નિયંત્રક

નકલ સવિનય રવાના જાણ સારૂ

(૧) મા સત્ય સચિવશ્રીના અગત મદદનીશશ્રી

નકલ રવાના જાણ તથા જરૂરી કાર્યવાહિ અર્થે

(૧) મુ.ઇ.શ્રી (તમામ), વડિ કચેરી, ગાંધીનગર.

(૨) સીની મેનેજર(ના/હિ), તમામ.

(૩) નાયબ મેનેજરશ્રી (ના/હિ), તમામ.

(૪) સીસ્ટમ મેનેજરશ્રી, કોમ્પ્યુટર સેલ, બોર્ડ કચેરી, ગાંધીનગર, (બોર્ડની વેબસાઇટ પર મુકવા સારૂ)

(૫) બીલ ટેબલ, વડિ કચેરી.

(૬) કૅશીયરશ્રી, વડિ કચેરી.


(૭) સુનિલ ઠક્કર એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

જન એલાયીશી /

12015

તા. 16/2015

ગરબી રવાના પ્રતિ ગાપલ કાર્યપાલક ડબ્લેસી
જા સા રર.પેચાલિ ભાગ ડબ્લેસી, કરજા, વડાદરા, સાવલી /
ડબ્લેસી તરફ જાગા સાઈ તપાલ પગ લેવાને લઈ અમલ
કરવા સારૂ



કાર્યપાલક ઈજનેર

જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ

ગુ. પાણી પુરવઠા અને ગટર વ્ય. બોર્ડ
વડોદરા.

ગરબી એકાઉન્ટ શાખા, એબી/વડાદરા, સાવલી, કરજા /
ડબ્લેસી / એસકે તરફ પાવલ તરફ જાગા સાઈ તપાલ
અમલ કરવા સારૂ

परिशिष्ट-अ

51. (1) Notwithstanding anything to the contrary contained in this Act, the Government may mandate, —

(a) a department or establishment of the Central Government or State

Government; or

(b) local authority; or

(c) Governmental agencies; or

(d) such persons or category of persons as may be notified by the Government on the recommendations of the Council,

(hereafter in this section referred to as "the deductor"), to deduct tax at the rate of one per cent. from the payment made or credited to the supplier (hereafter in this section referred to as "the deductee") of taxable goods or services or both, where the total value of such supply, under a contract, exceeds two lakh and fifty thousand rupees:

Provided that no deduction shall be made if the location of the supplier and the place of supply is in a State or Union territory which is different from the State or as the case may be, Union territory of registration of the recipient.

Explanation. —For the purpose of deduction of tax specified above, the value of supply shall be taken as the amount excluding the central tax, State tax, Union territory tax, integrated tax and cess indicated in the invoice.

(2) The amount deducted as tax under this section shall be paid to the Government by the deductor within ten days after the end of the month in which such deduction is made, in such manner as may be prescribed.

(3) The deductor shall furnish to the deductee a certificate mentioning therein the contract value, rate of deduction, amount deducted, amount paid to the Government and such other particulars in such manner as may be prescribed.

(4) If any deductor fails to furnish to the deductee the certificate, after deducting the tax at source, within five days of crediting the amount so deducted to the Government, the deductor shall pay, by way of a late fee, a sum of one hundred rupees per day from the day after the expiry of such five days period until the failure is rectified, subject to a maximum amount of five thousand rupees.

(5) The deductee shall claim credit, in his electronic cash ledger, of the tax deducted and reflected in the return of the deductor furnished under sub-section (3) of section 39, in such manner as may be prescribed.

(6) If any deductor fails to pay to the Government the amount deducted as tax under sub-section (1), he shall pay interest in accordance with the provisions of sub-section (1) of section 50, in addition to the amount of tax deducted.


(7) The determination of the amount in default under this section shall be made in the manner specified in section 73 or section 74.

(8) The refund to the deductor or the deductee arising on account of excess or erroneous deduction shall be dealt with in accordance with the provisions of section 54:

Provided that no refund to the deductor shall be granted, if the amount deducted has been credited to the electronic cash ledger of the deductee.

પરિશિષ્ટ-બ

માલ અને સેવાના સપ્લાય પર TDS કરવા/ ન કરવાની પરિસ્થિતિ દર્શાવતો ચાર્ટ



deduction has been made based on which the benefit of deduction shall be made available to the deductee. All the DDOs in the Government, who are performing the role as deductor have to register with the common portal and get the GST Identification Number (GSTIN).

3. The subject section which provides for tax deduction at source was not notified to come into force with effect from 1st July, 2017, the date from which GST was introduced. Government has recently notified that these provisions shall come into force with effect from 1st October, 2018, vide Notification No. 50/2018 – Central Tax dated 13th September, 2018.

4. For payment process of Tax Deduction at Source under GST two options can be followed, which are as under:

Option I: Generation of challan for every payment made during the month

Option II: Bunching of TDS deducted from the bills on weekly, monthly or any periodic manner

5. In order to give effect to the above options from 01.10.2018, a process flow of deduction and deposit of TDS by the DDOs has been finalised in consultation with CGA for guidance and implementation by Central and State Government Authorities. The process flow for Option I and Option II are described as under:

Option I - Individual Bill-wise Deduction and its Deposit by the DDO

6. In this option, the DDO will have to deduct as well as deposit the GST TDS for each bill individually by generating a CPIN (Challan) and mentioning it in the Bill itself.

7. Following process shall be followed by the DDO in this regard:

- (i) The DDO shall prepare the Bill based on the Expenditure Sanction. The Expenditure Sanction shall contain the (a) Total amount, (b) net amount payable to the Contractor/Supplier/Vendor and (c) the 2% TDS amount of GST.
- (ii) The DDO shall login into the GSTN Portal (using his GSTIN) and generate the CPIN (Challan). In the CPIN he shall have to fill in the desired amount of payment against one/may Major Head(s)

(CGST/SGST/UTGST/IGST) and the relevant component (e.g. Tax) under each of the Major Head.

- (iii) While generating the CPIN, the DDO will have to select mode of payment as either (a) NEFT/RTGS or (b) OTC. In the OTC mode, the DDO will have to select the Bank where the payment will be deposited through OTC mode.
- (iv) The DDO shall prepare the bill on PFMS (in case of Central Civil Ministries of GoI), similar payment portals of other Ministries/Departments of GoI or of State Governments for submission to the respective payment authorities.
- (v) In the Bill,
 - (a) the net amount payable to the Contractor; and
 - (b) 2% as TDSwill be specified
- (vi) In case of NEFT/RTGS mode, the DDO will have to mention the CPIN Number (as beneficiary's account number), RBI (as beneficiary) and the IFSC Code of RBI with the request to payment authority to make payment in favour of RBI with these credentials.
- (vii) In case of the OTC mode, the DDO will have to request the payment authority to issue 'A' Category Government Cheque in favour of one of the 25 authorized Banks. The Cheque may then be deposited along with the CPIN with any of branch of the authorized Bank so selected by the DDO.
- (viii) Upon successful payment, a CIN will be generated by the RBI/Authorized Bank and will be shared electronically with the GSTN Portal. This will get credited in the electronic Cash Ledger of the concerned DDO in the GSTN Portal. This can be viewed and the details of CIN can be noted by the DDO anytime on GSTN portal using his Login credentials.
- (ix) The DDO should maintain a Register as per proforma given in Annexure 'A' to keep record of all TDS deductions made by him during the month. This Record will be helpful at the time of filing Monthly Return (FORM GSTR-7) by the DDO. The DDO may

also make use of the offline utility available on the GSTN Portal for this purpose.

- (x) The DDO shall generate TDS Certificate through the GST Portal in FORM GSTR-7A after filing of Monthly Return

Option II - Bunching of deductions and its deposit by the DDO

8. Option-I may not be suitable for DDOs who make large number of payments in a month as it would require them to make large number of challans during the month. Such DDOs may exercise this option wherein the DDO will have to deduct the TDS from each bill, for keeping it under the Suspense Head. However, deposit of this bunched amount from the Suspense Head can be made on a weekly, monthly or any other periodic basis.

9. Following process shall be followed by the DDO in this regard:

- (i) The DDO shall prepare the Bill based on the Expenditure Sanction. The Expenditure Sanction shall contain the (a) Total amount, (b) net amount payable to the Contractor/Supplier/Vendor and (c) the 2% TDS amount of GST.
- (ii) The DDO shall prepare the bill on PFMS (in case of Central Civil Ministries of GoI), similar payment portals of other Ministries/Departments of GoI or of State Governments for submission to the respective payment authorities.
- (iii) In the Bill, it will be specified
 - (a) the net amount payable to the Contractor; and
 - (b) 2% as TDS
- (iv) The TDS amount shall be mentioned in the Bill for booking in the Suspense Head (8658 - Suspense; 00.101 - PAO Suspense; xx - GST TDS)
- (v) The DDO will require to maintain the Record of the TDS so being booked under the Suspense Head so that at the time of preparing the CPIN for making payment on weekly/monthly or any other periodic basis, the total amount could be easily worked out.
- (vi) At any periodic interval, when DDO needs to deposit the TDS amount, he will prepare the CPIN on the GSTN Portal for the amount (already booked under the Suspense Head).

- (vii) While generating the CPIN, the DDO will have to select mode of payment as either (a) NEFT/RTGS or (b) OTC. In the OTC mode, the DDO will have to select the Bank where the payment will be deposited through OTC mode.
- (viii) The DDO shall prepare the bill for the bunched TDS amount for payment through the concerned payment authority. In the Bill, the DDO will give reference of all the earlier paid bills from which 2% TDS was deducted and kept in the suspense head. The DDO may also attach a certified copy of the record maintained by him in this regard.
- (ix) The payment authority will pass the bill by clearing the Suspense Head operated against that particular DDO after exercising necessary checks.
- (x) In case of NEFT/RTGS mode, the DDO will have to mention the CPIN Number (as beneficiary's account number), RBI (as beneficiary) and the IFSC Code of RBI with the request to payment authority to make payment in favour of RBI with these credentials.
- (xi) In case of the OTC mode, the DDO will have to request the payment authority to issue 'A' Category Government Cheque in favour of one of the 25 authorized Banks. The Cheque may then be deposited along with the CPIN with any of branch of the authorized Bank so selected by the DDO.
- (xii) Upon successful payment, a CIN will be generated by the RBI/Authorized Bank and will be shared electronically with the GSTN Portal. This will get credited in the electronic Cash Ledger of the concerned DDO in the GSTN Portal. This can be viewed and the details of CIN can be noted by the DDO anytime on GSTN portal using his Login credentials.
- (xiii) The DDO should maintain a Register as per proforma given in Annexure 'A' to keep record of all TDS deductions made by him during the month. This Record will be helpful at the time of filing Monthly Return (FORM GSTR-7) by the DDO. The DDO may also make use of the offline utility available on the GSTN Portal for this purpose.

(xiv) The DDO shall file the Return in FORM GSTR-7 by 10th of the following month

(xv) The DDO shall generate TDS Certificate through the GSTN Portal in FORM GSTR-7A

10. Departments in Central Government should instruct all its DDOs under them to follow the above procedure for payment of GST TDS amount deducted from payments to be made to suppliers.

11. Difficulty, if any, in implementation of this circular may please be brought to the notice of Department of Revenue.

(Ritvik Pandey)
Joint Secretary to the Government of India

Annexure A

Record to be maintained by the DDO for filing of GSTR7

Sl. No.	GSTIN of the Deductee	Trade Name	Amount paid to the Deductee on which tax is deducted	Integrated Tax	Central Tax	State/UT Tax	Total

NOTIFICATION
FINANCE DEPARTMENT.

Sachivalaya, Gandhinagar.

Dated the 14th September, 2018.

Notification No. 50/2018-State Tax

Gujarat
Goods
and
Services
Tax Act,
2017

No.(GHN-89)/GST-2018/S.1(4)TH:- In exercise of the powers conferred by sub-section (3) of section 1 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) and in supersession of the Government Notification, Finance Department No.(GHN-82)/GST-2017/S.1(3)/TH dated the 15th September, 2017. Notification No. 33/2017-State Tax, except as respects things done or omitted to be done before such supersession, the Government of Gujarat hereby appoints the 1st day of October, 2018, as the date on which the provisions of section 51 of the said Act shall come into force with respect to persons specified under clauses (a), (b) and (c) of sub-section (1) of section 51 of the said Act and the persons specified below under clause (d) of sub-section (1) of section 51 of the said Act, namely:-

- (a) an authority or a board or any other body, -
 - (i) set up by an Act of Parliament or a State Legislature; or
 - (ii) established by any Government,with fifty-one percent. or more participation by way of equity or control, to carry out any function;
- (b) Society established by the Central Government or the State Government or a Local Authority under the Societies Registration Act, 1860 (21 of 1860);
- (c) public sector undertakings.

This notification shall be deemed to have been issued on the 13th day of September, 2018.

By order and in the name of the Governor of Gujarat,

K H Pathak
Joint Secretary to Government.

સરકારના વિવિધ વિભાગો/
ખાતાઓ દ્વારા જી.એસ.ટી. કાયદા
હેઠળ TDS માટે નોંધણી નંબર
લેવા બાબત.

ગુજરાત સરકાર
નાણાં વિભાગ

પરિપત્ર ક્રમાંક:-જીએસટી/૧૦૧૭/૧૦૯૭/જીએસટી સેલ
સચિવાલય, ગાંધીનગર.
તા. ૧૫/૦૮/૨૦૧૮

૧. વંચાણે લીધો :- નાણાં વિભાગનો તા.૧૮/૦૭/૨૦૧૭ નો પરિપત્ર ક્રમાંક-
જીએસટી/૧૦૧૭/૧૦૯૭/ જીએસટી સેલ
૨. વંચાણે લીધો :- નાણાં વિભાગનો તા.૨૫/૧૦/૨૦૧૭ નો પરિપત્ર ક્રમાંક-
જીએસટી/૧૦૧૭/૧૦૯૭/ જીએસટી સેલ
૩. વંચાણે લીધો :- નાણાં વિભાગનો તા.૦૮/૦૫/૨૦૧૭ નો પરિપત્ર ક્રમાંક-
જીએસટી/૧૦૧૭/૧૦૯૭/ જીએસટી સેલ
૪. નાણા વિભાગનું તા.૧૪-૮-૨૦૧૮નું જાહેરનામું ક્રમાંક. (GHN-89)/GST-
2018/S.1(4)TH.

ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ તથા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ
સર્વિસીસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ ની કલમ ૫૧ અનુસાર જ્યારે કોઈ સરકારી વિભાગ,
સ્થાનિક સત્તામંડળ અને સરકાર હસ્તકના જાહેર સાહસો રૂ.૨,૫૦,૦૦૦/- થી વધુની
કિંમતનું ટેન્ડર બહાર પાડીને વેરાપાત્ર ચીજવસ્તુઓ ખરીદે કે વેરાપાત્ર સેવાઓ મેળવે તો
ફૂલ ૨% (બે ટકા) ટેક્સ ડીડક્શન એટ સોર્સ કરવાનું થાય, જેમાં ૧% (એક ટકો)
ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અને ૧% (એક ટકો) સેન્ટ્રલ ગુડ્સ એન્ડ
સર્વિસીસ ટેક્સ હેઠળ કાપવાનો થાય અને **SGST: 00060010101** તથા **CGST:**
00050010101 સદરે, જે મહિનામાં ડીડક્શન થયું હોય તેના અંત પછીનાં ૧૦
દિવસની અંદર, સરકારી તિજોરીમાં જમા કરાવવાના રહેશે. વધુમાં, આ કપાત સામે
કોન્ટ્રાક્ટરને ટી.ડી.એસ.ની કપાત કરનારે નમૂના **GSTR-7A** માં પ્રમાણપત્ર આપવાનું
રહેશે તથા ઠરાવેલ સમય મર્યાદા મુજબ નમૂના **GSTR-7** માં પત્રક ભરવાનું રહેશે.

આ કલમનો અમલ જી.એસ.ટી. કાઉન્સિલની ભલામણ મુજબ તા.૩૦-૯-
૨૦૧૮ સુધી મુલતવી રાખેલ હતો, જેનો અમલ હવે સંદર્ભમાં વંચાણે લીધેલા તા.૧૪-
૮-૨૦૧૮ના જાહેરનામા અનુસાર તા.૧-૧૦-૨૦૧૮ થી કરવાનો થાય છે, જેના માટે
ગુજરાત જીએસટી અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૨૫ તથા ગુજરાત જીએસટી રૂલ્સ,
૨૦૧૭ના નિયમ ૧૨ (૧) અન્વયે ટેન્ડર દ્વારા ખરીદી કરનાર કે સેવા મેળવનાર
સરકારી સક્ષમ અધિકારીએ નમૂના **GST REG-07** માં અરજી કરીને નોંધણી દાખલો
મેળવવાનો રહે છે.

ઉક્ત જોગવાઈઓનો અમલ તમામ સરકારી વિભાગ, સ્થાનિક સત્તામંડળ અને સરકાર હસ્તકના જાહેર સાહસોએ તા.૧-૧૦-૨૦૧૮ થી કરવાનો હોઈ, તાત્કાલિક અસરથી જીએસટી નેટવર્ક ઉપર ઓન-લાઈન વિગતો ભરીને તથા જરૂરી પૂરાવા અપલોડ કરીને નોંધણી દાખલો મેળવી લેવો જરૂરી બને છે. આથી, સર્વે વિભાગો, ખાતાના વડા, તાબાની તમામ કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ, જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, શહેરી વિકાસ સત્તામંડળ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત તેમજ સરકારી બોર્ડ અને કોર્પોરેશન, સરકારી કંપનીઓ, એસપીવી, વગેરે ને તેમના કાર્યક્ષેત્ર અને કામગીરી અનુસાર લાગુ પડવાપાત્ર હોય તો સત્વરે નોંધણી દાખલો મેળવી લેવા જણાવવામાં આવે છે. સદર કામગીરી માટે કોઈ કાયદાકીય માર્ગદર્શન કે ટેકનિકલ માર્ગદર્શન માટે જરૂર જણાય તો નજીકની રાજ્ય કર કચેરી અથવા જીએસટી નેટવર્કની હેલ્પલાઈન અથવા રાજ્ય કર કમિશનર દ્વારા અમદાવાદ અને અન્ય કચેરીઓમાં શરૂ કરવામાં આવેલ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમનાં નામે

14/10/2018

(કે.એચ.પાઠક)

સંયુક્ત સચિવ (ટેક્સ)

નાણાં વિભાગ.

નકલ રવાના જાણ તથા જરૂરી અમલ સાર:-

- સચિવાલયનાં સર્વે વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી/અગ્રસચિવશ્રી/ સચિવશ્રી
- તમામ કલેક્ટરશ્રી તથા ડીડીઓશ્રી
- તમામ બોર્ડ/કોર્પોરેશન
- તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ



T. H. Dholakia

Member Secretary

Gujarat Water Supply & Sewerage Board

Jalseva Bhavan, Sector - 10/A, Gandhinagar

Phone No. (079) 23251048

Fax: (079) 23225979

Website: www.gwssb.gujarat.gov.in

E-mail: fcgwssb@gmail.com



No. AB/SM-1-2/GST/File No 71/ 126 /2017

Di 04-06-2017

To,
M/S Sunil B. Thakkar & Co.,
302, Harsh Avenue,
Navjivan Press Road,
Income tax,
Ahmedabad

Sub.: Acceptance of your proposal for migration of existing TDN No(s) in to
GST Registration no. of our Divisions.
Ref. :- Your letter Dated 16-05-2017

Sir,

This is with reference to your above letter. It is to be intimated that your above proposal has been accepted by the Gujarat Water Supply & Sewerage Board (GWSSB) with following conditions:

- (1) All the existing VAT-TDN No. are to be migrated in to the GST Registration no(s) in the stipulated time schedule, as per the mandate given under respective provisions of the Act/Rules/Notification by the concerned authorities.
- (2) For this purpose, the GWSSB will provide following details to your firm
 - (2.1) The information of existing TDN No(s), address and contact details of respective offices.
 - (2.2) The necessary documents required for this purpose
 - (2.3) Any other information necessary for this purpose
- (3) You are authorized to-
 - (3.1) Visit the concerned VAT Circle offices and avail the information required for this purpose
 - (3.2) Register your mobile no. & mail id for password reset, if required
 - (3.3) Use prevailing ID & Password of respective offices for the purpose of this migration process.

(Note: A separate authority letter is enclosed herewith for this purpose.)
- (4) You will be paid Rs. 1500/- (Rupees One thousand five hundred only) for each completed migration. The cost of the USB Token (if required) for Digital Signature and applicable taxes shall be paid in addition to this. The payment

ADT -
15 copy

shall be made after successful completion of this assignment and furnishing the satisfactory documentary evidences to the GWSSB in this regards.

- (5) In case of the work not completed properly and in time, without any fault on part of GWSSB the payment shall be decreased accordingly. Further, a penalty as decided by the Finance Controller of the GWSSB (not exceeding to 10% of total payment) may be imposed
- (6) in case of any dispute the decision of the Member Secretary of the GWSSB will be final and bindings.
- (7) It is to be very clearly informed that all the information, ID-Passwords and documents provided to you are for the sole purpose of the migration in to GST. It shall remain the property of GWSSB and you or your representative(s) shall not use it for any other purpose except this.


- (8) You may contact following officers of our Head Office for this purpose

Name & Designation of Officer	Contact No.
Mr. B. J. Dave, Deputy Finance Controller	99784 06541
Mr. B. B. Chauhan, Senior Manager (F/A)	99784 06513
Mr. R. P. Lalwani, Deputy Manager (F/A)	99784 41949

- (9) The jurisdiction will be of Gandhinagar in case of any legality.

Enclosure: As above

Yours Faithfully,


(T. H. Dholakia)
Member Secretary

Copy to

- (1) Finance Controller, GWSSB, Gandhinagar.
(2) Sr. Manager, (F & A), H.O., Gandhinagar.